

## SARDAR PATEL UNIVERSITY

B. Sc. [ III- SEM.] EXAMINATION-2019

PHYSICAL CHEMISTRY : US03CCHE02

DATE : 25/11/2019.

TIME : 02:00 TO 05:00 p.m.

DAY : MONDAY TOTAL MARKS 70.

Q.-1. Choose and rewrite the correct options for the following MCQs.

[10]

1. Which of the following represent the correct equation for free energy change?  
 (a)  $\Delta G = \Delta H + T\Delta S$       (b)  $\Delta G = \Delta H - T\Delta S$   
 (c)  $\Delta G = \Delta H + \Delta T$       (d)  $\Delta G = \Delta H - \Delta S$
2. If a gas expand into vacuum, there is no opposing force, work obtained by the system is as, \_\_\_\_\_  
 (a) Zero      (b) Maximum  
 (c) Much less      (d) None of these
3. The relation between the entropy change and heat energy is, \_\_\_\_\_  
 (a)  $ds = dq / T$       (b)  $ds = dq \cdot T$   
 (c)  $ds = dq$       (d) None of these
4. Isotonic solution must have the, \_\_\_\_\_  
 (a) Same temperature      (b) Same osmotic pressure  
 (c) Same molar concentration      (d) All of these
5. The mole fraction of a solvent is 0.8. The relative vapour pressure lowering of a nonvolatile solute dissolved in it is, \_\_\_\_\_  
 (a) 60%      (b) 40%      (c) 20%      (d) 30%
6. The pressure necessary to stop the osmosis is called, \_\_\_\_\_ pressure.  
 (a) Equilibrium      (b) Osmotic  
 (c) Static      (d) Vapour
7. The unit of specific conductance is, \_\_\_\_\_  
 (a)  $\text{Ohm}^{-1}$       (b)  $\text{Ohm m}$   
 (c)  $\text{Ohm}^{-1} \text{m}^{-1}$       (d) Mho
8. Which of the following statement is correct for weak electrolyte?  
 (a) Partially dissociated in an aqueous solution.  
 (b) Acetic acid is an example of weak electrolyte.  
 (c) Molar conductivity remains approximately constant as the conc. increase.  
 (d) All of these
9. Which of the following substance used to prepare the reference electrode?  
 (a)  $\text{ZnCl}_2$       (b)  $\text{Hg}_2\text{Cl}_2$   
 (c)  $\text{CuSO}_4$       (d)  $\text{KNO}_3$
10. The salt-bridge in the electrochemical cell serves to, \_\_\_\_\_  
 (a) Increase the rate of redox reaction      (b) Increase the voltage of the cell  
 (c) Maintain the electrical neutrality      (d) None of these

(1)

(P.T.O.)

- Q.-2.** Answer the following questions in short. [ ANY TEN ]. [20]
1. Discuss the Carnot theorem.
  2. Define isochoric process for entropy with equation.
  3. What are the limitations of first law of thermodynamics?
  4. Define the terms : (i) Osmosis                   (ii) Boiling point
  5. State Raoult's law. Give mathematical expression.
  6. Why osmotic pressure is a colligative property? Explain with equation.
  7. What do you meant by inert and reacting electrode? Give example.
  8. Explain the term ionic strength ( $\mu$ ). Give the mathematical expression.
  9. State Kohlrausch's law with its limitation.
  10. Identify the type of electrodes :
    - (i) pt / H<sub>2</sub> / HCl      (ii) Ag / AgCl / Cl<sup>-</sup>      (iii) Zn / Zn<sup>+2</sup>      (iv) pt / Fe<sup>+2</sup>, Fe<sup>+3</sup>
  11. Calculate the mechanical energy ( $\Delta U$ ) for the cell reaction :
 
$$\text{AgCl}_{(s)} + \frac{1}{2}\text{H}_2_{(g)} \rightleftharpoons \text{Ag}_{(s)} + \text{H}^+_{(aq)} + \text{Cl}^-_{(aq)}$$
 and  $E_{\text{cell}}^0$  is given  
 $E_{\text{cell}}^0 = 0.2223$  volt. (  $F = 96500$  C ).
  12. Give the symbolic representation and cell reaction of a Daniel cell.
- Q.-3.**
- (A) Define the term Gibbs free energy. How is each of these terms related to maximum work that can be done by the system during a given change? [06]
  - (B) Derive an expression for entropy of a mixture of an ideal gases. [04]
- OR
- Q.-3.**
- (A) Derive the concept of entropy from the second law of thermodynamics and show that entropy is a state function. [06]
  - (B) One mole of an ideal mono atomic gas expands reversibly from a volume of 10 liter and temperature 298 K to a volume of 20 liter and temperature 250 K. Assuming that  $C_v = 3/2 R$ , calculate the entropy change for the process. (  $R = 8.314 \text{ J K}^{-1} \text{ mol}^{-1}$  ). [04]
- Q.-4.**
- (A) Derive an expression correlating the molal elevation constant and elevation in boiling point when a non-volatile solute is added to a pure solvent. [06]
  - (B) At 25° C, the osmotic pressure of human blood due to the presence of various salt in the blood is 7.65 atm. Assuming that molarity equals molality, calculate the freezing point of blood. (  $K_f = 1.86 \text{ K Kg mol}^{-1}$  &  $R = 0.08206 \text{ lit atm.K}^{-1} \text{ mol}^{-1}$  ) [04]
- OR
- Q.-4.**
- (A) Explain the term depression in freezing point. Describe the Beckmann method for determining freezing point depression. [06]
  - (B) What would be the vapour pressure of a 0.5 molal solution of a non-volatile solute in benzene at 30° C? The vapour pressure of pure benzene at 30° C is 119.6 torr. Molar mass of benzene is 78 gm mol<sup>-1</sup>. [04]

(2)

- Q.-5.
- (A) What is electrolysis? Explain electrolysis of HCl solution by considering three compartments. [06]
- (B) Discuss the Arrhenius theory of electrolyte dissociation. [04]  
OR
- Q.-5.
- (A) What is ionic mobility? Derive an expression for the determination of ionic mobility through the measurements of conductance of solution at voltage V. [06]
- (B) When a conductance cell was filled with 0.02 M aqueous solution of KCl which has a specific conductance of  $0.2767 \text{ ohm}^{-1}\text{m}^{-1}$ , it had a resistance of  $82.39 \Omega$ . When the same cell was filled with  $2.5 \times 10^{-3}$  M solution of  $\text{K}_2\text{SO}_4$ , its resistance was  $325 \Omega$ . Calculate the cell constant and specific conductance of  $\text{K}_2\text{SO}_4$  solution. [04]
- Q.-6. How will you determine the equilibrium constant of a cell reaction and solubility product of sparingly soluble salt with the help of emf measurement. Explain with example. [10]  
OR
- Q.-6. Derive Nernst equation for measuring emf of a cell and calculate the cell potential for the following cell reactions at  $25^\circ\text{C}$ . [10]
- $\text{Mg} \longrightarrow \text{Mg}^{+2}_{(0.01 \text{ M})} + 2\text{e}^- , E^0 = +2.34 \text{ volt}$
- $\text{Sn}^{+2}_{(0.1 \text{ M})} + 2\text{e}^- \longrightarrow \text{Sn} , E^0 = -0.136 \text{ volt.}$
- (Activity of pure elements at standard state is unity)

—X—  
③



બેંક નંબર:

[63/A-19]  
[63]

છપેલ પેજ: 03

સરદાર પટેલ યુનિવર્સિટી  
 બી.એસ.સી. [સેમેસ્ટર - III] પરીક્ષા - 2019  
 ભૌતિક રસાયણશાસ્ત્ર : US03CCHE02

તારીખ : 25/11/2019

સમય : 02થી 05p.m. સુધી

વાર : સોમવાર

કુલ માર્ક્સ : 70

- Q.1. નીચેના MCQs માટે ઓગથ વિકલ્પ પસંદ કરી ફરીથી લખો. [10]
- નીચેના માંથી મુક્તઉર્જાનો ફેરફાર દર્શાવતું ક્યું સમીકરણ સાચું છે?
 

(અ)  $\Delta G = \Delta H + T\Delta S$       (બ)  $\Delta G = \Delta H - T\Delta S$   
       (ક)  $\Delta G = \Delta H + \Delta T$       (સ)  $\Delta G = \Delta H - \Delta S$
  - શૂન્યાવકાસમાં વિસ્તરણ પામતા વાયુ માટે, વિરોધભળ લાગતું ન હોય ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય \_\_\_\_\_ હોય છે.
 

(અ) શૂન્ય      (બ) મહત્તમ  
       (ક) ધંધું ઓછું      (સ) આમાંથી કોઈપણ નહીં
  - એન્ટ્રોપી ફેરફાર અને ઉષ્માઉર્જા વચ્ચેનો સંબંધ \_\_\_\_\_ છે.
 

(અ)  $ds = dq/T$       (બ)  $ds = dq \cdot T$       (ક)  $ds = dq$       (સ) આમાંથી કોઈપણ નહીં
  - સમઅભિસારી દ્વાવણો માટે,
 

(અ) તાપમાન સરખું હોય      (બ) અભિસરણ દબાણ સરખું હોય  
       (ક) મોલર સાંક્રતા સરખી હોય      (સ) આ બધુજ હોય
  - દ્રાવણમાં દ્રાવક ના મોલ અંશ 0.8 હોય ત્યારે દ્રાવક માં ઓગાળતા અબાધ્યાત્મિલ દ્રાવ્ય પદાર્થ ના દ્રાવણ માં સાપેક્ષ બાધ્યદબાણમાં થતો ઘટાડો \_\_\_\_\_ થાય.
 

(અ) 60 %      (બ) 40 %      (ક) 20 %      (સ) 30 %
  - અભિસરણ બંધ કરવા જરૂરી દબાણ ને \_\_\_\_\_ દબાણ કરે છે.
 

(અ) સંતુલન      (બ) અભિસરણ      (ક) સ્થિર      (સ) બાધ્ય
  - વિશ્લેષણવાહકતા નો એકમ \_\_\_\_\_ છે.
 

(અ) ઓહમ<sup>-1</sup>      (બ) ઓહમ મિટર      (ક) ઓહમ<sup>-1</sup> મિટર<sup>-1</sup>      (સ) મ્હો
  - નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે નીચેના વિધાનો માથી શું સાચું છે?
 

(અ) જલીય દ્રાવણ માં તેનું આંશિક વિયોજન થાય છે.  
       (બ) એસિટિક એસિડ એ નિર્બળ વિદ્યુતવિભાજ્ય નું ઉદાહરણ છે.  
       (ક) સાંક્રતા વધારતા મોલર વાહકતા લગભગ અચળ રહે છે.  
       (દ) આ બધાજ
  - સંદર્ભ ધૂવ બનાવવા માટે નીચેના માથી ક્યો પદાર્થ વપરાય છે ?
 

(અ)  $ZnCl_2$       (બ)  $Hg_2Cl_2$       (ક)  $CuSO_4$       (સ)  $KNO_3$

①

(P.T.O.)

- 10 विद्युतरासायणिक कोष मां क्षार-सेतु नुं कार्य, \_\_\_\_\_
- (अ) रेडीक्ष प्रक्रिया नो वेग वधारे छे      (ब) कोष पोटेन्शियल वधारे छे  
 (क) विद्युत तत्त्वस्थाना जाणवे छे      (द) आमाशी कोईपछ नही
- Q.2. नीचेना माथी कोईपछ इस प्रश्नोना टूकमां जवाब आपो. [20]
1. कानोट प्रमेयनी थर्ची करो.
  2. एन्ड्रोपी माटे समकदी प्रकम समजावी तेनुं समीकरण लभो.
  3. उभागतिशास्त्र ना प्रथम नियम नी मर्यादाओ लभो.
  4. पद व्याख्यायित करो : (i) अभिसरण      (ii) उत्कलनबिंदु
  5. राउल्टनो नियम लभो. तेनुं गाणितिक स्वरूप आपो.
  6. अभिसरणबाण शा माटे संभ्यात्मक गुणधर्म छे? समीकरण नी मद्द थी समजावो.
  7. सकिय अने निष्ठिय धूव ऐढले शु? उदाहरण आपो.
  8. आयोनिक प्रबलता (μ) पद समजावो. तेनुं गाणितिक समीकरण लभो.
  9. कोहलस नो नियम लभो अने तेनी मर्यादा जणावो.
  10. नीचे आपेल विद्युतधूवो ना प्रकार जणावो.  
 (i)  $\text{pt} / \text{H}_2 / \text{HCl}$     (ii)  $\text{Ag} / \text{AgCl} / \text{Cl}^-$     (iii)  $\text{Zn} / \text{Zn}^{+2}$     (iv)  $\text{pt} / \text{Fe}^{+2}, \text{Fe}^{+3}$
  11. आपेल कोष प्रक्रिया माटे यांत्रिक उर्जा ( $\Delta U$ ) नुं मुल्य गाणो.  
 $\text{AgCl}_{(s)} + 1/2\text{H}_2_{(g)} \leftrightarrow \text{Ag}_{(s)} + \text{H}^+_{(aq)} + \text{Cl}^-_{(aq)}$  अनेकोष  
 $E^\circ_{\text{वैध}} = 0.2223$  वोल्ट,  $F = 96500$  कुलंब आपेल छे).
  12. डेनियल कोष माटे सांकेतिक निःरूपण अने कोष प्रक्रिया लभो.
- Q.3.
- (A) गिभ मुक्तउर्जा पद समजावो. प्रणाली मां थयेल कोईपछ फेरफार दरम्यान ते महत्तम कार्य नुं सूचन करे छे ते आनी साथे संकल्पना तारवो अने पुरवार करो के एन्ड्रोपी ए स्थिति विधेय छे. [06]
- (B) आदर्श वायु माटे मिश्रण (mixture) नी एन्ड्रोपी शोधवानुं समीकरण तारवो. [04]  
 अथवा
- (A) उभागतिशास्त्र ना बीजा नियम नी मद्द थी एन्ड्रोपी संकल्पना तारवो अने पुरवार करो के एन्ड्रोपी ए स्थिति विधेय छे. [06]
- (B) एक मोल आदर्श वायु ना एक अयु नुं प्रतिवर्ती विस्तरण थतां तेनु कड 10 लिटर अने तापमान 298 K मांथी कड 20 लिटर अने तापमान 250 K थाय छे. तो प्रक्रिया (विस्तरण) दरम्यान थतो एन्ड्रोपी फेरफार गाणो. ( $R = 8.314 \text{ J K}^{-1}\text{mol}^{-1}$ ) [04]

(2)

Q.4.

- (A) જ્યારે અભાષ્પશીલ ગ્રાવ્ય ને શુદ્ધ ગ્રાવક માં ઉમેરવામાં આવે ત્યારે મોલલ ઉજ્જ્વલન અચળાંક અને ઉત્કલનબિંદુ માં થતાં ઉજ્જ્વલન વચ્ચે નો સબંધ દર્શાવતું સમીકરણ તારવો. [06]
- (B)  $25^{\circ}\text{C}$  તાપમાને લોહીમાં જુદાજુદા ક્ષારો હોવાના કારણે માનવલોહી નું અભિસરણ-દબાણ 7.65 atm (વાતાવરણ) છે. ધારીલો કે મોલારીટી બરાબર મોલાલિટી હોય તો, લોહી નું ડારબિંદુ શોધો. ( $K_f = 1.86 \text{ KKg mol}^{-1} & R = 0.08206 \text{ lit.atmK}^{-1}\text{mol}^{-1}$ )
- અથવા

Q.4.

- (A) ઠારબિંદુ અવનયન પદ સમજાવો. ઠારબિંદુ અવનયન શોધવા માટે બેકમેન પદ્ધતિનું વર્ણન કરો. [06]
- (B)  $30^{\circ}\text{C}$  તાપમાને 0.5 મોલલ અભાષ્પશીલ પદાર્થ ના ગ્રાવણ નું બેઝિન(Benzene) માં બાષ્પદબાણ કેટલું હશે? શુદ્ધ બેઝિન નું બાષ્પદબાણ  $30^{\circ}\text{C}$  તાપમાને 119.6 ટોર છે. બેઝિન(Benzene) નો અણુભાર 78 ગ્રામ મોલ<sup>-1</sup> છે.

Q.5.

- (A) વિદ્યુતવિભાજન એટલે શું ? HCl ના ગ્રાવણ નું વિદ્યુતવિભાજન ત્રણ ભાગ માની લઈ ને સમજાવો. [06]
- (B) વિદ્યુતવિભાજ્ય વિયોજન માટે આરહેનિયસ(Arrhenius) સિદ્ધાંત ની ચર્ચા કરો. [04]
- અથવા


Q.5.

- (A) આયનિક ચલનશીલતા એટલે શું? વોલ્ટેજ V એ વાહકતામાપન ના આધારે આયનોની આયનિક ચલનશીલતા શોધવા માટે નું સમીકરણ તારવો. [06]
- (B) 0.02 M KCl ના જલીય ગ્રાવણ થી ભરેલા વાહક કોષ ની વિશિષ્ટ વાહકતા  $0.2767 \text{ ohm}^{-1}\text{m}^{-1}$  અને તેનો અવરોધ  $82.39 \text{ ohm}$  છે. જ્યારે સમાન કોષ  $2.5 \times 10^{-3} \text{ M}$   $\text{K}_2\text{SO}_4$  ના ગ્રાવણ થી ભરેલો છે અને તેનો અવરોધ  $325 \text{ ohm}$  છે, તો કોષ અચળાંક અને  $\text{K}_2\text{SO}_4$  ના ગ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા શોધો.

- Q.6. EMFમાપન પદ્ધતિ ની મદદ થી કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને અલ્ફાગ્રાવ્ય ક્ષાર નો ગ્રાવ્યતા ગુણાકાર કરી રીતે શોધી શકાય? ઉદાહરણ આપીને સમજાવો. [10]

અથવા

- Q.6. કોષ પોટેન્શિયલ શોધવા માટે નર્ન્સ્ટ(Nernst) નું સમીકરણ તારવો અને નીચે આપેલ કોષ પ્રક્રિયા માટે  $25^{\circ}\text{C}$  તાપમાને કોષ પોટેન્શિયલ ની ગણતરી કરો. [10]



(પ્રમાણિત પરિસ્થિતી માં શુદ્ધ તત્ત્વો ની સહિત્યતા એક (unity) હોય છે).

